



GUJARAT INTRUX LIMITED
STEEL AND ALLOY STEEL
CASTING MANUFACTURERS

GIL/SEC/OCT/27/2023-24

OCTOBER 31, 2023

To,

BSE LTD.

25th FLOOR, P. J. TOWER
DALAL STREET,
MUMBAI-400 001.

SUB.: PUBLICATION OF FINANCIAL RESULTS IN NEWSPAPER

Dear Sir/Madam,

With reference to above subject, we enclosed herewith copy of Newspapers Cutting of Financial Results published in the following Newspapers.

- (1) **The Economic Times**: English language (Ahmadabad Edition)
Dated October 31, 2023, Tuesday.
- (2) **Nav Gujarat Samay**: Gujarati language (Ahmadabad Edition)
Dated October 31, 2023, Tuesday.

Kindly take the same in your record.

Thank you

Yours sincerely,

For **Gujarat Intrux Limited**

RAJYAGURU
SAGAR
RAMESHBHAI

Digitally signed by
RAJYAGURU SAGAR
RAMESHBHAI
Date: 2023.10.31 16:13:06
+05'30'

SAGAR RAJYAGURU

Company Secretary & Compliance Officer

Encl.: As above

CIN No. L27100GJ1992PLC016917
REGD. OFFICE & WORKS :
Survey No. 84/P.
17 Km. Rajkot-Gondal Road,
Village Shapar. Pin-360 024.
RAJKOT (INDIA)

Phone : +91 - 2827 - 252851,
e-mail : info@intricastindia.com,
info@gujaratintrux.com
Website : www.intricastindia.com
www.gujaratintrux.com



Markets: Beating Volatility

Half a Glass of Equity and the Other Half in Debt Best Mix



Market Trends

STOCK INDICES	% CHANGE
Nifty 50	19141 0.49
Sensex	64113 0.52

MSCI India	1284	0.38	Nikkei	30697	0.95
MSCI EM	2372	0.36	Hang Seng	17406	0.04
MSCI BRIC	547	0.21	Kospi	2311	0.34
MSCI World	12514	0.05	Straits Times	3064	0.08




OIL (\$/BRL)	DUBAI CRUDE
	89.29
	1.17

GOLD RATE	
US (500)	India (1030GM)
OPEN 2013.50	61396.00
LAST 2003.90	61160.00
Prev (6) chg 0.27	0.01

FOREX RATE (IN \$ Exchange Rate)	
OPEN	LAST
83.26	83.25

SENSEX UP 329 POINTS Indices Log Gains for a 2nd Day on Buying in HDFC Bank, RIL and ICICI



PTI

Mumbai: Equity Benchmarks Sensex and Nifty closed higher for the second straight session on Monday as buying in index majors Reliance Industries, HDFC Bank and ICICI Bank helped the indices rebound from early lows amid a mixed trend in global markets. Besides, weakening Brent crude oil prices overseas also boosted investor confidence amid simmering tensions in the Middle East, traders said.

Recovering after a sell-off in morning trade, the 30-share BSE Sensex jumped 329.85 points or 0.52 per cent to settle at 64,112.65. During the day, it rallied 401.78 points or 0.62 per cent to 64,181.58.

The Nifty advanced 83.65 points or 0.49 per cent to 19,140.90. Domestic equities saw some buying interest boosted by impressive corporate earnings and increasing hope that US Fed might keep the interest rate on hold in its upcoming meeting on November 1. Siddhartha Khemka, Head Retail Research, Motilal Oswal Financial Services Ltd, said.

Among the Sensex firms, Ultra-Tech Cement, Reliance Industries, ICICI Bank, HDFC Bank, Bharti Airtel, IndusInd Bank, State Bank of India, Tata Consultancy Services, Larsen & Toubro, Kotak Mahindra Bank and State Bank of India were the major gainers.

Value of trades in interbank market down nearly 40% in the past four years

Fall in Call Money Trades may Limit RBI Rate Move Impact

Bhaskar Dutta@timesgroup.com

Mumbai: The answer to the Reserve Bank of India's (RBI) question why its rate actions are not completely transmitted through the economy may lie in the shrinking trade volume in the very segment the central bank targets through its monetary policy — the overnight call money market.

The value of trades in the inter-bank call money market, which helps lubricate the financial system and is the operating target of the RBI's monetary policy, has shrunk nearly 40% in the past four years, official data showed. Meanwhile, trades in the two other money market segments — market repos and tri-party repos — have trebled, posing a tricky question for the RBI about its rate-action impact on the economy.

"The growing importance of these markets is a potential source of dissonance for monetary policy operations, which targets the weighted average call rate (WACR) as the operating rate. It is the anchor for short-term money market instruments," said Saugata Bhattacharya, Executive Vice President, Axis Bank. "If



FILE PHOTO

these rates diverge for sustained periods from the WACR, particularly in skewed distribution as presently evident, this might impede efficient transmission of monetary policy signals."

TRANSMISSION CHANNELS

When the RBI increases or decreases interest rates to either curb inflation or spur economic growth, it expects the changes in policy rates to be effectively transmitted from the overnight call money market to the broader economy. Banks borrow and lend funds from each other in the call market.

Data released by the Clearing Corporation of India showed that

Treasury Bills will become more and more linked with the other money market segments and that has an implication for broader fundraising instruments like certificates of deposit (CD) and commercial papers (CP) as well," said Navneet Singh, head of trading at ICICI Securities Primary Dealership. CDs are instruments used by banks to raise short-term funds, while CPs are securities issued by corporates to garner money. Pricing of these is linked to the government's T-bills.

POOLED FUNDS

The reasons behind the fall in call market volumes and the increased preference for the collateralised segments include a sharp increase in the flow of funds toward mutual funds and insurance companies following the 2016 demonetisation exercise and the COVID crisis four years later.

Mutual funds, which are not permitted access to the window that banks use to lend to the RBI, are huge players in the tri-party repo market, while insurance firms also opt for collateralised lending and borrowing.

"As the volumes diverge further, pricing of instruments such as

Maruti Races Ahead on Multiple Boosters, but Can't Leave Demand Concerns Behind

Ashutosh Shyam @timesgroup.com

ET Intelligence Group: The premiumisation-led earnings growth amid benign raw material costs has prompted analysts to upgrade earnings estimates of Maruti Suzuki India.

Operating profit before depreciation and amortisation (Ebitda) of India's largest car maker expanded by 370 basis points year-on-year to 12.9% in the September quarter — the highest level in 20 quarters. This was around 100 basis points above the consensus estimates. Absolute Ebitda per ve-

hicle hit a record high of Rs 87,000 per unit.

"The maker of Brezza and Swift cars was able to expand the margin helped by lower input costs and rising sales of high-priced sports utility vehicles (SUVs). SUV's share in the total domestic volume rose to 27.3% in the September 2023 quarter from 19.7% eight quarters ago. It sold 125,121 SUV units in the second-quarter of FY24, when industry wide volume was 5.5 lakh units. That translates into a 23% market share compared with 16.4% a year ago.

After dwindling for the last few

years, company's SUV market share is back to the FY18-19 level, thanks to a spate of launches that filled a critical void in the product mix.

Maruti's overall market share rose by 170 basis points year-on-year to 43.1% in the September quarter. The average selling price increased by 15% year-on-year to Rs 6.7 lakh per unit while the sales volume grew by 6.4%.

The share of SUVs in the total domestic volume is expected to be 28% for FY24 and may touch 27% in the next fiscal year. This may result in a 12% domestic volume

growth for FY24, a stronger potential performance compared with the company's guidance of 5% industry growth.

The ratio of raw material prices to sales dropped by 249 basis points year-on-year to 70.6%. As a result, the gross margin per vehicle of Maruti Suzuki touched a record high of Rs 1.97 lakh per unit.

On the flip side, the share of low-priced hatchbacks in the total volume fell to 35% in the September quarter, compared with 51% a year ago. With push sales continuing in the hatchback and sedan segment, average discount per vehicle inched up to Rs 17,700 per unit in the September quarter.

MERGER TO OPEN MICROFINANCE OPPORTUNITIES

AU Small Fin Bank to Acquire Fincare SFB in All Share Deal

Fincare promoter co to infuse ₹700 crore into bank before merger


Our Bureau

Kolkata | Mumbai: AU Small Finance Bank is all set to acquire Fincare Small Finance Bank in an all share deal and merge it with itself in a first consolidation of small finance banks since their entry into India's banking lexicon about six-seven years back.

The shareholders of Fincare Small Finance Bank will receive 579 equity shares of AU Small Finance Bank for every 2,000 shares held. The merger would be effected from February 1, 2024, according to a regulatory filing to stock exchanges late Sunday.

The deal is subject to Fincare Business Services, which owns about 70% in Fincare SFB, infusing Rs 700 crore of capital into the bank before the merger. Fincare Business Services is owned by multiple private equity funds including the home-grown True North. Shareholders of Fincare Business will end up holding about 8% share in the merged entity.

"One thing we were missing in microfinance which we are getting now is the chance to understand the south market emotionally and cultu-



rally," he said. AU is the largest small finance bank with Rs 11,783 crore net worth and a balance sheet size of Rs 65,977 crore at the end of the second quarter to September 30. It has 170 branches and 1042 touch points, heavily skewed in favour of Rajasthan, Maharashtra and Punjab. In contrast, about half of Fincare's 1300 touchpoints are in South India.

The Bengaluru-headquartered Fincare had Rs 10541 crore of gross loan portfolio at the end of June with microfinance contributing 54% of it. At the end of September, Fincare's gross NPA was 1.6% while AU's was 1.9%.

When the Reserve Bank of India offered 10 small finance bank licences in 2015 to push financial inclusion, AU was the only asset-backed lender without microfinance lineage to receive it. Out of the other nine, eight licences were given to microfinance lenders and another to a local area bank.

AU started operation from Jaipur as a non-bank vehicle financier in 2003. AU's gross advances stood at Rs 65,029 crore at the end of September with 95% secured loan assets and vehicle loans accounting for about one-third of it. AU started its banking operation in April 2017.

APL APOLLO TUBES LIMITED

CIN: L74899DL1986PLC02543
 Regd. Office: 37, Hargobind Enclave, Vikas Marg, Delhi-110092
 Corp. Office: 36, Kaushambi, Near Anand Vihar Terminal, Ghaziabad 201010
 Email: info@aplapollo.com | Website: www.aplapollo.com
 Tel: 0120-6614100

REVENUE

17%

YOY

EBITDA

42%

YOY

PA

35%

YOY

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023				
(₹ in Crs. except earning per share data)				
S.No.	Particulars	Quarter ended		Quarter ended
		Sept 30, 2023	Sept 30, 2023	Sept 30, 2022
1	Total Income from Operations	4,630.40	9,175.30	3,969.21
2	EBITDA	344.62	673.53	243.47
3	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	276.66	537.51	202.26
4	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	276.66	537.51	202.26
5	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	202.87	396.49	150.19
6	Total Comprehensive income for the period	208.68	412.26	152.72
7	Equity Share Capital	55.47	55.47	55.43
8	Other Equity	-	-	-
9	Earnings Per Share (face value of ₹ 2/- not annualised for quarterly figures)			
	Basic:	7.32	14.30	6.00
	Diluted:	7.31	14.29	5.41

Notes: (₹ in Crs.)

- Brief of Standalone Financial Results for the quarter and half year ended 30 September, 2023:

Particulars	Quarter ended		Quarter ended
	Sept 30, 2023	Sept 30, 2023	Sept 30, 2022
Income from Operations	3,724.91	7,373.82	3,771.36
Profit Before Tax	184.70	398.41	163.09
Profit After Tax	132.89	293.46	121.47

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Financial Results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website "www.aplapollo.com".

Place: Ghaziabad
Date: 30 October, 2023

For APL Apollo Tubes Limited
Sd/-
Sanjay Gupta
Chairman & Managing Director

REVOLUTIONIZING THE WORLD OF TUBES WITH

NAYI SOCH

World's first company to produce tubes from 8x8 to 1000x1000mm with 0.38 to 40mm thickness.

WALMART, BATA STORE

A TRULY INDIAN FOUNDRY WITH A GLOBAL PRESENCE!

GUJARAT INTRUX LIMITED
 CIN: L27100GJ1992PLC016917
 Regd. Office: Survey No. 84/P, 17 K.M. Rajkot-Gondal Road, Village: Shapar, Dist: Rajkot-360 024, India

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2023				
Particulars	Quarter ended	Year to date	Corresponding	Year to date
	30.09.2023	30.09.2023	30.09.2022	30.09.2022
Total Income from operations (net)	1535.32	2823.97	1294.13	5143.82
Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	326.23	535.74	183.15	764.64
Net Profit/ (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	326.23	535.74	183.15	764.64
Net Profit/ (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	234.59	388.68	139.08	573.83
Total Comprehensive income for the period ((Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	234.59	388.68	139.08	572.60
Equity Share Capital	343.53	343.53	343.53	343.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	5508.70	5508.70	5299.52	5463.55
Earning Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised except last column)				
Basic:	6.83	11.31	4.05	16.67
Diluted:	6.83	11.31	4.05	16.67
Earning Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualised except last column)				
Basic:	6.83	11.31	4.05	16.67
Diluted:	6.83	11.31	4.05	16.67

Notes:

[1] The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended on 30.09.2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and amendments thereon. The full format of the financial results are available on the website of the Company's website at www.gujaratintrux.com.

[2] This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

FOR AND ON BEHALF OF THE BOARD OF GUJARAT INTRUX LIMITED

DHIRAJ D. PAMBHAR
MANAGING DIRECTOR
DIN - 00187311

PLACE : SHAPAR (Dist. RAJKOT)
DATE : 30-10-2023

GUJARAT INTRUX LIMITED
 STEEL AND ALLOY STEEL SAND CASTING

Survey No. 84/P, 17 K.M. Rajkot-Gondal Road, Village: Shapar, Dist: Rajkot-360 024, India
 Phone : 02827-252851 www.gujaratintrux.com

‘ખોટી બે આની’ અને ‘અમે બધાં’: જ્યોતિન્દ્ર દવે દ્વારા લિખિત બે અદભૂત અને અમર હાસ્ય રચનાઓ

જ્યોતિ સાહિત્યના ખ્યાતનામ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેનો જન્મ ૨૧મી ઓક્ટોબર, ૧૯૦૮ના રોજ દિલ્હિ ગુજરાતના મુઘલ શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૩૮માં મૅટ્રિક, ૧૯૪૨માં બી.એ. અને ૧૯૪૬માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૪૨ થી ૧૯૭૩ સુધી તેઓ મુંબઈમાં કાન્યાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યની ક્રિયાશીલ લખવાના કાર્યમાં જોડાયા. મુનશી જીવ્યાં હતા એટલે ઘોડો સમય તેમણે ક્રિયાશીલ હાઈફ્રેક્વન્સી અધ્યાપન કાર્ય કર્યું. તેમણે ‘ગુજરાત’ માસિકનું સહ-સંપાદન પણ કર્યું. ૧૯૭૩ થી ૧૯૭૭ દરમિયાન તેમણે સુરતની અમદાવાદ શ્રેણિકમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. કાન્યાલાલ મુનશીની વિનયી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં અધ્યાપકરત્વનું કામ ૧૯૫૬માં નિવૃત્ત થયા ત્યાં સુધી કર્યું. તેમણે ‘ખોટી બે આની’ વિનયિ શ્રેણિકમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માઈની, ક્રમ્બ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેને ૧૯૮૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના મુખ્ય સહાધ્યક્ષ તરીકે નિમણૂક મળી. તેમણે ૧૯૮૭માં ‘ખોટી બે આની’ નામના પુસ્તકો લખ્યાં અને પિતૃના નામ પરિવર્તન કરીને તેમને લખવા પડ્યા. ૧૯૮૨માં કમ્પ્યુટરના સાથે થયાં હતાં અને મુખી રમા, પુસ્તક પ્રદીપ, અસ્મિતાના નામો વિતાવ્યાં. તેમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમનું પર સુરતના આશિષવિદ્ય વિસ્તારમાં આવેલું છે.



અમે બધાં

‘અમે બધાં’ પનનુલકાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવે દ્વારા લખવામાં આવેલાં ગુજરાતી હાસ્ય નવલકથા છે. ૧૯૭૬ના વર્ષમાં પ્રગટ થયેલી આ નવલકથા આત્મકથાના સ્તરીમાં લખવામાં આવી છે. આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં, સમગ્રભારત નીકટની ભદ્રામળ પછીની, બીજા ક્રમની સર્વ નવલકથા માનવામાં આવે છે. તે ઉપરાંત, બે લેખકો દ્વારા સંયુક્ત રીતે લખાઈ શોષ તેના આ પ્રથમ ગુજરાતી નવલકથા છે.

જ્યોતિન્દ્રનું ઘણું જુરુ હાસ્ય ચાર્ટીલા વિધાનની માફક સમસ્યામાયી પીડા દેલવે અને પીડામાંથી હાસ્ય પેદા વાય. જ્યોતિન્દ્ર દવેએ આવી કેટલીય પીડાઓને કાગળ પર દેતારી છે અને આપણને હસતા રાખ્યા છે. જ્યારે તેમનાં હાસ્યનિબંધોમાંથી પસંદગી કરવાની વાત આવે ત્યારે ‘ખોટી બે આની’ને સમાવિષ્ટ કરતા કોઈ સંપાદક પોતાની જાતને રોડી શકતો નથી.

હાસ્યમાં ખોટી બે આની આવી ગઈ છે અને એ ગમે તે બોગે તેનાથી છુટકારો ઉઠશે છે. પણ ખોટી બે આની અર્થી પુર ઉછાગરની નાનાના સ્વરૂપે છે. તેના અનુભવમાંથી છુટકારો મેળવવો કઠીન છે. વચ્ચે વચ્ચે હાસ્યના પ્રસંગો આવતા રહે છે. અહીં જ્યોતિન્દ્ર સ્વયં હાસ્યની સાથે સાથે સુખ્ય હાસ્યનું મિશ્રણ કરે છે અને હસાવે છે. નિબંધ તો હાસ્યનો છે પણ તેની છતાંથી મર્મપ્રધાન નામનું ગુલાબ ખાંચુ છે.

જ્યોતિન્દ્રને એના સમયાના વિવેચકો હસતા ફિલ્મસુક તરીકે ઓળખાવે છે. જ્યોતિન્દ્ર જ્યારે કન્ડક્ટરને મરવા મોઢે જાય છે ત્યારે એક સરસ વિધાન કરવું છે. ‘જુદી વસ્તુને પોતાની જોશરૂબ કરવું પડ્યું મન હોય છે.’ વેપારીનું પાણ તો ઘણું બહેલ છે કે આ આની બોલે છે પરંતુ કેટલાક માનવોના મુખનું અવલોકન કરતા આપણને આશ આવી જાય છે કે તે સુંદર માગે છે. કન્ડક્ટરના અનામી પુત્ર આગળ જ્યોતિન્દ્ર જે રીતે છલાવટ કરે છે તેની બુદ્ધિમાન અને નિરીક્ષકી આસીમ પુષ્કરનો નિબંધમાં લેખકને યા પીળોની હજી સમય તો નથી થયો પણ પોતાનું કામ પાર પી જાય એટલે એ સમય અવધિ પૂર્વે યા પીલા રેડોરનમાં જાય છે. મુખ્ય પુઠના કાષ્ટક માટે નીતિ નિમણૂનો ઉદ્દેશ્ય કરતા પરોક્ષમાં પચાલો મનોની જ્યોતિન્દ્રના એક જ નિમણૂમાંથી માનવજીવનનું સુખતામાં કેટલાય ઠંઠાં ઉઘાડાં પડે છે. પરંતુ તે અહીં એક માનવ અથ માનવની સાથે કોઈ રહેલી હુચ્ચારીના અગણિત ઘાલભા ભરેલા પચા. છે. જ્યોતિન્દ્ર ઉચ્ચતા તો પોતાની લાલ્ચીક ઠંઠાથી આ લેખકને વધારે લાગુ અને પાટાર બનાવી શકતા, જેની સમુપક્રિયામાં જરા અમથી પણ ઉની અંચ ન આવત, પણ જ્યોતિન્દ્ર જણે છે કે તેમણે ઉની અડકવું અને ક્યાં લંબાવવું આપણે ઉજરને સ્મારે યા રાહીએ છીએ? જ્યારે અહીં સમસ્યામાં સ્થાયા ઘોરેને વચ્ચે. નહીં તો ઉજર પ્રકાશ ફિલાવ સ્યાં થાય આવે છે. જ્યોતિન્દ્રના વાલ્મ વાંચી તેને મુદ્દિગીનો સમજ જરા - ‘ફાસા લેવા માટે ગલ્લા પાસે ઊભા પુરુનો આંખો બહી નામની હોય એમ મને લાગ્યું અને ‘ઉજર ગલી ઉજરનો

વિચારો પુરુ, લખી ને સ્ત્રીના પાયામાં સહાયતા આપવાનો ભારડો જાય છે. એ પાવલીની ક્યા રાકતો નથી. કદાચ તેણા જ માટે પોતાના માનકિક સંપત્તિને ખાતર એ સ્ત્રી થવા લખીને વંચવખત કરેલાં શીયો ઘરો!

ખોટી બે આનીનું પ્રકાશ કરવા જતાં લેખક પાવલીની ભરાઈ જાય છે. એ પાવલીની ક્યા રાકતો નથી. કદાચ તેણા જ માટે પોતાના માનકિક સંપત્તિને ખાતર એ સ્ત્રી થવા લખીને વંચવખત કરેલાં શીયો ઘરો!

‘અમે બધાં’ નવલકથા 27 પ્રસંગોમાં વહેંચાયેલી છે, જેમાંથી અર પ્રકરણ પુનઃપ્રલખલ મહેતા અને પંદર પ્રકરણ જ્યોતિન્દ્ર દવેએ લખ્યાં છે. બંને લેખકો પોતાનું પ્રયોજન જણાવતાં પામે છે. ‘અમારા તત્ત્વ સૂરતનાં અલ્પય થતાં જતાં જીવન અને વાણસજા પુરુવૃત્ત અલ્પ જ થાય તે પહેલાં તેમને આજુ વિજ ઝીલી લેવું એવો વિચાર અમને અને જુદો-જુદો આવેલો છે તે માટે છે. અમે જુદો-જુદો મોઢો નેપે પણ તૈયાર કરીએ!’ સમગ્ર નવલકથા પ્રથમ પુસ્તક એકવચનમાં કહેવાઈ છે. નવલકથામાં કોઈ સવળ કથા કહેવામાં નથી આવી, પરંતુ સુરતના જીવન વિષયક પ્રસંગો કુતિના કેન્દ્રમાં છે. સમગ્ર કથા સ્વ આલ્પમાં વિકાસ પામે છે: મુરત શહેર, એનાં સંસ્થા એક નાગર શાહીનો સંયુક્ત પરિવાર, એનાં પવિત્રમાં જન્મથી મારીને લગ્નવચ્ચે પરિવર્તિત થવાનાં કથિતને અનુભવેલાં આનંદો, મુંબઈનો, સ્વાય-ઉત્તર અને વિધાઈ. આમ કથામાં વિવિધતા જન્મી તેના લગ્ન સુધીના પ્રસંગો પ્રાથમમાં આયા છે.

પ્રથમ પ્રકરણ ‘મૂની’ પર નોંધમાં ‘પચા’માં ભિખી પોતે જ પોતાનો જીવ કેવી રીતે ચલો તેની કથા કહે છે. એ પછી તે પોતાના જાત કહે જવાવર મુદ્દેપરિનેાં હાસ્યરચકા પરકામો વર્લે છે અને મોસાલમાં ગણેલા ફિલ્મનો હાસ્યરસિત નોપ આપે છે.

‘અમે બધાં’ નવલકથા 27 પ્રસંગોમાં વહેંચાયેલી છે, જેમાંથી અર પ્રકરણ પુનઃપ્રલખલ મહેતા અને પંદર પ્રકરણ જ્યોતિન્દ્ર દવેએ લખ્યાં છે. બંને લેખકો પોતાનું પ્રયોજન જણાવતાં પામે છે.

‘અમે બધાં’ નવલકથા 27 પ્રસંગોમાં વહેંચાયેલી છે, જેમાંથી અર પ્રકરણ પુનઃપ્રલખલ મહેતા અને પંદર પ્રકરણ જ્યોતિન્દ્ર દવેએ લખ્યાં છે.

પહેલી વાર અવકાશમાં ઉડરનાં ભૂણ વિકસાવવામાં સફળતા

પાનગ સંશોધકોએ પ્રથમ વખત ઉપર-રેન્ડમલ સ્પેસ સેક્ટર પર ઉડરનાં ભૂણ વિકસાવવામાં સફળતા મેળવી છે. યામાનારી મુનિવર્સિટીની ટીમે સફળતાપૂર્વક ભૂણમાં જ્વાલોસિસ્ટમાં ઉડરના ફાઇવર ઉડાનો વિકાસ કર્યો છે. આ સફળ પ્રયોગ એ વાતાનો સંકેત છે કે માસલ પણ અવકાશમાં પ્રજનન કરી શકે છે.

સંકળાયેલા પ્રોફેસર તેરુકિમી ધાકાવ્યામાં કહે છે કે પ્રયોગ પરથી અને એવા તારણ પર આધાર છીએ કે મુખ્ય મુરુત્ત્વપૂર્ણભાષાં પ્રજા નાનો વિકાસ સામાન્ય રીતે જ્વાલોસિસ્ટ સ્ટેજ સુધી થાય છે. આ દુકલિને ઓગસ્ટ 2022માં ઓછા તાપમાનમાં જમા કરેલાં ભૂણોને અંતરિક્ષામાં મોકલ્યાં હતા. આ સંશોધનમાં જાપાનીઝ સોરેસેપે એજન્સી ના વેલાકિસ પલ સાથે હતા, જેઓ આ ભૂણોને ઓરિજેસેસ પર લઈ ગયા હતા.

આ સંશોધન iScience જર્નલમાં પ્રકાશિત થયું છે. આ સંશોધન સાથે અવકાશ યાત્રીઓ આ ભૂણોને

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સેન્ટી.પી. બિલામ
ટેલર નોટિસ નં. ૫૭૨૭૨૩-૨૦૨૪

શાંતી કામ

1. ટીકા પ્રલવક બલેનરમુ પુલોડી ગામમાં ઠેલવાની ઘાસે મુખ્ય પ્રકારનું એકામ બંધાવવાનું સંકલન કરી શકે છે. આ સંકલન અંગે સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે.

2. SIRC work of Pump motor set with Electrical, Mechanical & Instrumentation equipment with 1 year DLP for Sump Type Drainage Pumping Station at Near Cozy Hotel Bohrapura Ward, South Zone of AMC.

નોંધાવેલા ટેન્ડર બંધાવવાની ઠીકણી તારીખ અને સમય:
ટેન્ડરિક્ષા નોંધ આપવાની તારીખ અને સમય:
ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય:
ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય:
www.tender.apjcorpc.com

પશુચિકિત્સા સેવેલ-વડોદરા વિભાગ

ઓપન ઈ-ટેન્ડર નોટિસ

ટેન્ડર નં. ૬૫/170/2023/23-24/2023, પશુચિકિત્સા સેવેલ વડોદરા વિભાગ હેલે મેનેજર ઈલેક્ટ્રીકલ ઈન્જીનિયર પશુચિકિત્સા સેવેલ વડોદરા. 230004 ઘાસ મેળવવા માટે ટેન્ડર પ્રકાશિત છે. આ ટેન્ડર નં. ૬૫/170/2023/23-24/2023, ટેન્ડરિક્ષા નોંધ આપવાની તારીખ અને સમય: ૧૬.૧૦.૨૦૨૩, ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય: ૧૬.૧૦.૨૦૨૩, ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય: ૧૬.૧૦.૨૦૨૩. ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય: ૧૬.૧૦.૨૦૨૩. ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય: ૧૬.૧૦.૨૦૨૩. ટેન્ડરિક્ષા ફાઇલ કરવાની તારીખ અને સમય: ૧૬.૧૦.૨૦૨૩.

યુનિકલ્ચર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (બારીશ તાપોલીન)

તેના લોકપ્રિય બ્રાન્ડ નામ ‘બારીશ તાપોલીન’ દ્વારા જાણીતા, એસ.ડી.પી.ઇ. તાપોલીન ઉત્પાદકના શ્રેણમાં અગ્રણી રહી છે. ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણની પ્રતિબદ્ધતા સાથે, આ ઉપકારો ઉદ્યોગમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે.

બારીશ તાપોલીન

હાઇડ્રોક્સી પોલિઇથિલિન એસ.ડી.પી.ઇ. તાપોલીન ઉત્પાદકના શ્રેણમાં અગ્રણી રહી છે. ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણની પ્રતિબદ્ધતા સાથે, આ ઉપકારો ઉદ્યોગમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે.

યુનિકલ્ચર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (બારીશ તાપોલીન)

તેના લોકપ્રિય બ્રાન્ડ નામ ‘બારીશ તાપોલીન’ દ્વારા જાણીતા, એસ.ડી.પી.ઇ. તાપોલીન ઉત્પાદકના શ્રેણમાં અગ્રણી રહી છે. ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણની પ્રતિબદ્ધતા સાથે, આ ઉપકારો ઉદ્યોગમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે.

બારીશ તાપોલીન

હાઇડ્રોક્સી પોલિઇથિલિન એસ.ડી.પી.ઇ. તાપોલીન ઉત્પાદકના શ્રેણમાં અગ્રણી રહી છે. ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણની પ્રતિબદ્ધતા સાથે, આ ઉપકારો ઉદ્યોગમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે.

A TRULY INDIAN FOUNDRY WITH A GLOBAL PRESENCE!

GUJARAT INTRUX LIMITED (બારીશ તાપોલીન)
CIN: L27100G1992PLC016917
Regd. Office: Survey No. 84/P, 17 K.M. Rajkot-Gondal Road, Village: Shapur, Dist: Rajkot-360 024, India

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2023

Particulars	Quarter ended 30.09.2023	Year-to-date figures 30.09.2023	Corresponding 3 Months ended in the previous year 30.09.2022	Previous year ended 31.03.2023
	(IN-Rupees)	(IN-Rupees)	(IN-Rupees)	(IN-Rupees)
Total Income from operations (net)	1555.32	2823.97	1294.13	5143.82
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	326.23	535.74	183.15	764.64
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	326.23	535.74	183.15	764.64
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	234.59	388.68	139.08	573.83
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	343.53	343.53	343.53	343.53
Equity Share Capital	343.53	343.53	343.53	343.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	5508.70	5508.70	5299.52	5463.55
Earning Per Share (before extraordinary items) (IN-Rs. 10/- each) (not annualised except last column)	6.83	11.31	4.05	16.67
Diluted:	6.83	11.31	4.05	16.67
Earning Per Share (after extraordinary items) (IN-Rs. 10/- each) (not annualised except last column)	6.83	11.31	4.05	16.67
Diluted:	6.83	11.31	4.05	16.67

Notes:

[1] The above is an extract of the detailed formal of Financial Results for the quarter and half year ended on 30.09.2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and amendments thereof. The full form of the financial results are available on the website of ISSE at www.intrux.com and on Company's website at www.gujaratintrux.com.

[2] This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

FOR AND ON BEHALF OF THE BOARD OF GUJARAT INTRUX LIMITED

DHIRAJ P. PAMBHAR
MANAGING DIRECTOR
DIN - 05173711

GUJARAT INTRUX LIMITED
STEEL AND ALLOY STEEL SAND CASTING
Survey No. 84/P, 17 K.M. Rajkot-Gondal Road, Village: Shapur, Dist: Rajkot-360 024, India
Phone : 02827-252851 www.gujaratintrux.com